



ગુજરાત જાહેર સેવા આયોગ

સેક્ટર-૧૦-એ, "૭-૩" સર્કલ પાસે, "૭" રોડ, ગાંધીનગર-૩૮૨૦૧૦
ફોન નં- (૦૭૯) ૨૩૨ ૫૮૯૮૦ Web Site : <https://gpsc.gujarat.gov.in>

અગત્યની જાહેરાત

આયોગ દ્વારા તારીખ ૧૫.૦૭.૨૦૧૯ ના રોજ જાહેરાત ક્રમાંક ૦૧/ ૨૦૧૯-૨૦ થી ૧૨/૨૦૧૯-૨૦ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ જાહેરાતો અન્વયે ઓન લાઇન અરજી કરવાની સમય મર્યાદા તા.૧૫.૦૭.૨૦૧૯, ૧૩:૦૦ કલાક થી ૩૧.૦૭.૨૦૧૯ ૧૩:૦૦ કલાક સુધી હતી. રાજ્યમાં વડોદરા જિલ્લો અને અન્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ ધ્યાને લઈ, સદરહુ જાહેરાતો ઓનલાઇન અરજી કરવા માટે તારીખ ૦૩.૦૮.૨૦૧૯ ૧૩:૦૦ કલાક થી તારીખ ૦૮.૦૮.૨૦૧૯ રાતનાં ૨૩:૫૯:૫૯ સુધી ફરીથી Open કરવામાં આવે છે. ઓન લાઇન અરજી <https://gpsc-ojas.gujarat.gov.in/> પરથી કરવાની રહેશે.

અગત્યની સૂચના :

- (૧) જે ઉમેદવારોએ તા. ૩૧.૦૭.૨૦૧૯ સુધીમાં ઓનલાઇન અરજી કરેલ હોય તેવા ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની રહેતી નથી.
- (૨) જે ઉમેદવારોએ અગાઉ અરજી કરી હોય અને તેમાં કોઈ સુધારો કરવાનો હોય તો ઉમેદવારો તે કરી શકશે.
- (૩) બિનઅનામત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ના નાણા ભરવા માટે ઓનલાઇન ઈ-પેમેન્ટ તા. ૦૮.૦૮.૨૦૧૯, ૧૩:૦૦ કલાક સુધી તથા પોસ્ટ ઓફીસના માધ્યમથી પોસ્ટલ ચલણ ડાઉન લોડ કરી તારીખ ૦૮.૦૮.૨૦૧૯, ૧૩:૦૦ કલાક સુધીમાં ભરી શકાશે. જે ઉમેદવારો અગાઉ અરજી ફીનાં નાણા ભરવાનું ચૂકી ગયેલ હતા તેઓ પણ આ સમય દરમિયાન અરજી ફી નાં નાણા આ બે વિકલ્પો પૈકી એકનો ઉપયોગ કરીને ભરી શકશે.
- (૪) આ જાહેરાતો અન્વયે ઓનલાઇન અરજી કરવા માટેની મુદત વધારવા સિવાયની જાહેરાતોની બધી જ જોગવાઈઓ તારીખ ૧૫.૦૭.૨૦૧૯ના રોજ પ્રસિધ્ધ થયેલ જાહેરાત ક્રમાંક : ૦૧/૨૦૧૯-૨૦ થી ૧૨/૨૦૧૯-૨૦ માં દર્શાવ્યા મુજબ રહેશે. એટલે કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે માટે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૩૧.૦૭.૨૦૧૯ ધ્યાને લેવામાં આવશે. જ્યારે Non Creamy Layer Certificate અને EWS Certificate તા. ૦૮.૦૮.૨૦૧૯ સુધીમાં ઇસ્યુ થયેલ હશે, તો તે માન્ય ગણવામાં આવશે.

તા. ૦૩.૦૮.૨૦૧૯

ગાંધીનગર